

**JD-102**

January-2021

B.Com., Sem.-V

305 : Statistics – V

Time : 2 Hours]

[Max. Marks : 50]

સૂચના: (1) સાદાકેલક્યુલેટરનો ઉપયોગ કરી શકશો.

(2) આલેખપત્ર વિનંતીથી મળી શકશો.

(3) વિભાગ-A માંથી ગમે તે બે પ્રશ્નોના જવાબ લખો. દરેક પ્રશ્નના ગુન સરખા છે.

(4) વિભાગ-B ફરજિયાત છે.

## વિભાગ - A

1. (A) (i) નિયત સંકલનના કોઈપણ પાંચ ગુણધર્મો લખો.

10

(ii) સંકલન મેળવો :  $\int \frac{3^x \cdot e^{2x} + e^{3x}}{e^{2x}} dx$

(B) નીચેનામાંથી ગમે તે બે ગણો :

10

(i)  $\int \left( \frac{x^2}{x+3} \right) dx$

(ii)  $\int \left( \sqrt[3]{x} - \frac{1}{2}x + \frac{5}{\sqrt[3]{x}} \right) dx$

(iii)  $\int_{5}^{10} (30-x)^4 dx$

2. (A) (i) પોયશન વિતરણની વ્યાખ્યા આપી તેના ગુણધર્મો જણાવો.

10

(ii) 52 પત્તાની જોડમાંથી યદૃચ્છ રીતે ત્રણ પત્તા લેવામાં આવે તો

(a) ત્રણેય પત્તા રાણીના હોય

(b) ત્રણેય લાલ(hearts) ના હોય તેની સંભાવના શોધો.

(B) પોયશન વિતરણનો મધ્યક = 3 છે, તો  $P(x \geq 2)$  ની કિંમત મેળવો.

10

$(e^{-3} = 0.049)$

3. (A) ટૂંકનોંધ લાગો : ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તામાં ચલન  
(B) એક ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન દર અડધા કલાકે 4 એકમોના એક એવા નિદર્શ લઈ તેમનું ગુણવત્તા  
લક્ષણ માપવામાં આવે છે. દિવસ દરમ્યાન ભળોલ માહિતી નીચે મુજબ છે. તે પરથી રે અને R  
આલોખ દોરી પ્રક્રિયા નિયંત્રણ અંગે તમારુ મંતવ્ય જણાવો.  
ભવિષ્યના ઉત્પાદન માટેની નિયંત્રણ રીમાણો પણ મેળવો.

ନିଶ୍ଚିନ୍ତନ.	1	2	3	4	5	6	7	8	9	10
$\Sigma x$	1316	1272	1340	1348	1312	1280	1304	1364	1324	1420
R	35	20	5	10	5	40	50	20	30	67

(n = 4 માટે A<sub>2</sub> = 0.73, D<sub>3</sub> = 0, D<sub>4</sub> = 2.28)

4. (A) કિયા લક્ષણ વકનો અર્થ સમજાવી તેના ગુણાધમો જણાવો.  
(B) એક નિર્દર્શન યોજના (100, 10, 1) માટે  $AQL = 0.02$  અને  $LTPD = 0.05$  હોય તો ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનાં જોખમ શોધો.

ପିଲାତ୍ର - B

## માન્ય મુજબ જવાબ આપો : (ગમે તે પાંચ)

- (1) નોંધીમાંત આમદાની = ₹ 13 હોય તો કુલ આમદાની \_\_\_\_\_ થાય.

(a)  $13x$       (b)  $13 + C$       (c)  $13x + C$

(2) પોયશાન વિતરણ માટે મધ્યક 8 છે તો તેનું પ્રમાણિત વિચલન \_\_\_\_\_ થાય.

(a) 8      (b)  $\sqrt{8}$       (c)  $8^2$

(3) p-નકશામાં ખાંખી પ્રમાણનું વિતરણ \_\_\_\_\_ હોય છે.

(a) પ્રામાણ્ય      (b) પોયશાન      (c) ટ્રિપદી

(4) એક નિર્દર્શન યોજના (2000, 15, 3) સમજાવો.

(5)  $\int \left( \frac{1}{6-7x} \right) dx = \underline{\hspace{2cm}}$

- (a)  $-\frac{1}{7} \log(6-7x) + C$
- (b)  $\log(6-7x) + C$
- (c)  $-\frac{1}{7} \log(6-7x) + C$

(6) અતિ ગુણોત્તર વિતરણના કોઈપણ બે ગુણધર્મો લખો.

(7) R નકશા માટે જો CL = 21.47, D<sub>3</sub> = 0, D<sub>4</sub> = 2.28 હોય તો LCL = \_\_\_\_\_.

- (a) 0
- (b) 48.9516
- (c) 19.19

(8) એક નિર્દર્શન યોજના (100, 18, 1) માટે ખામી પ્રમાણ P<sup>1</sup> = 0.01 અને સમૂહના સ્વીકારની સંભાવના P<sub>a</sub> = 1 હોય તો ATI ની કિંમત મેળવો.

(9) આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણમાં આલેખ (નકશા) માં પોથશન વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે.

- (a)  $\bar{x}$  -આલેખ
- (b) c -આલેખ
- (c) d -આલેખ

(10) કાચની શીશી (બોટલ) માં રહી ગયેલા હવાના પરપોટાની સંખ્યા \_\_\_\_\_ વિતરણનું ઉદાહરણ છે.

- (a) પ્રામાણ્ય
- (b) પોથશન
- (c) છિપદી

Seat No. : \_\_\_\_\_

# JD-102

January-2021

B.Com., Sem.-V

305 : Statistics – V

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :**
- (1) Simple calculator can be used.
  - (2) Graph paper will be supplied on request.
  - (3) Attempt any two questions from Section – A. All questions carry equal marks.
  - (4) Section – B is compulsory.

## Section – A

1. (A) (i) Write any five properties of Definite Integral. 10

(ii) Evaluate :  $\int \frac{3^x \cdot e^{2x} + e^{3x}}{e^{2x}} dx$

(B) Solve any two from the following: 10

(i)  $\int \left( \frac{x^2}{x+3} \right) dx$

(ii)  $\int \left( \sqrt[3]{x} - \frac{1}{2}x + \frac{5}{\sqrt[3]{x}} \right) dx$

(iii)  $\int_{5}^{10} (30-x)^4 dx$

2. (A) (i) Give definition of Poisson distribution. Also state its properties. 10

(ii) Three cards are drawn at random from a pack of 52 cards. Find the probabilities that

(a) all the cards are of queens  $52C_3$

(b) all are heart  $52C_3$

(B) For a Poisson distribution, if mean = 3, then find  $P(x \geq 2)$  10

$$(e^{-3} = 0.049)$$

3. (A) Write short note on Causes of variations in a production process.

10

(B) Sample of 4 units each is taken at every half an hour and quality characteristics are measured. The data obtained during a day are as under. Draw  $\bar{x}$  and R chart and state your conclusion.

Also, obtain control limit for future production.

10

Sample No.	1	2	3	4	5	6	7	8	9	10
$\Sigma x$	1316	1272	1340	1348	1312	1280	1304	1364	1324	1420
R	35	20	5	10	5	40	50	20	30	67

(For  $n = 4$ ,  $A_2 = 0.73$ ,  $D_3 = 0$ ,  $D_4 = 2.28$ )

4. (A) Explain operating characteristic curve and write its characteristics.

10

(B) Find producer's risk and consumer's risk for a single sampling plan (100, 10, 1) when AQL = 0.02 and LTPD = 0.05.

10

## Section – B

Do as directed : (any five)

10

(1) If marginal revenue = ₹ 13, then total revenue = \_\_\_\_\_.

(a)  $13x$

(b)  $13 + C$

(c)  $13x + C$

5

P.T.O.

(2) Mean of a Poisson distribution is 8, then its standard deviation = \_\_\_\_\_.

(a) 8

(b)  $\sqrt{8}$

(c)  $8^2$

(3) Distribution of fraction defective in p-chart is \_\_\_\_\_

(a) Normal

(b) Poisson

(c) Binomial

(4) Explain single sampling plan (2000, 15, 3).

(5)  $\int \left( \frac{1}{6-7x} \right) dx = \underline{\hspace{2cm}}$

(a)  $\frac{1}{7} \log(6-7x) + C$

(b)  $\log(6-7x) + C$

(c)  $-\frac{1}{7} \log(6-7x) + C$

(6) State any two properties of hypergeometric distribution.

(7) For R-chart : CL =  $\bar{D}$ ,  $D_3 = 0$ ,  $D_4 = 2.28$ , then LCL = \_\_\_\_\_.

(a) 0

(b) 48.9516

(c) 19.19

(8) For a single sampling plan (100, 18, 1) proportion of defective of the lot  $P^1 = 0.01$  and probability of the acceptance of lot  $P_a = 1$ , find ATI.

(9) Poisson distribution is used in \_\_\_\_\_ chart of statistical quality control.

- (a)  $\bar{x}$ -chart
- (b) c-chart
- (c) d-chart

(10) Number of air bubbles in a glass bottle follows \_\_\_\_\_ distribution.

- (a) Normal
- (b) Poisson
- (c) Binomial